| <b>Seat No.:</b> |  |
|------------------|--|
|------------------|--|

## **AF-113**

#### April-2016

#### B.Com., Sem.-VI

# CE-303(D) : Computer Application (Information Security)

| Time: 3 Hours] |     |  | [Max. Marks: 35 |
|----------------|-----|--|-----------------|
| 1.             | (a) | Information Security એટલે શું ? Informationની લાક્ષણિકતાઓ જણાવે<br><b>અથવા</b><br>સમજાવો :<br>(1) Access<br>(2) Worms<br>(3) Password crack                      | i. 3            |
|                | (b) | ઇન્ફોર્મેશન સીક્યુરીટીના બધા ભાગો જણાવો.<br><b>અથવા</b>  | 2               |
|                | (c) | "Balancing of Information Security and Access" ઉપર નોંધ લખો.<br>Security ના બધા જ લેયર સવિસ્તારથી સમજાવો.<br>અથવા<br>"Information Security" ઇતિહાસ ઉપર નોંધ લખો. | 2               |
| 2.             | (a) | Threat એટલે શું ? જાણીતા Threatનું list કરો.<br>અથવા   | 3               |
|                | (b) | એટેક એટલે શું ? સવિસ્તાર સમજાવો.<br>સમજાવો :<br>(1) Dictionary<br>(2) Spam<br>અથવા   | 2               |
|                | (c) | Risk Control Strategies સમજાવો. Business માં ઈન્ફોર્મેશન સીક્યુરીટીની જરૂરિયાત જણાવો. અથવા Risk Management સમજાવો.   | 2               |
| 3.             | (a) | VPN પર નોંધ લખો.<br><b>અથવા</b>  | 3               |
|                |     | Firewalls એટલે શું ? તેના Processing mode જણાવો.   |                 |
| AF-            | 113 | 1  | P.T.O.          |

|    | (b)  | Access Control સમજાવો.<br>અથવા                        |                   |                                   | 2 |
|----|------|---|-------------------|-----------------------------------|---|
|    |      | સમજાવો :  |                   |                                   |   |
|    |      | (1) Circuit Gateway                                   |                   |                                   |   |
|    |      | (2) Hybrids Firewall                                  |                   |                                   |   |
|    | (c)  | "Application Gateways" સમજાવો.                        |                   |                                   | 2 |
|    | (-)  | અથવા  |                   |                                   |   |
|    |      | "Firewall Categories by Structure" સમજা               | .વો.              |                                   |   |
| 4. | (a)  | Cryptography એટલે શું ? Cryptography ન<br><b>અથવા</b> | l too             | I જણાવો.                          | 3 |
|    |      | Digital Signature અને Digital Certificate             | વચ્ચેન            | નો તફાવત જણાવો.                   |   |
|    | (b)  | Steganography એટલે શું ? સમજાવો.                      |                   |                                   | 2 |
|    |      | અથવા  |                   |                                   |   |
|    |      | Public Key Infrastructure સમજાવો.                     |                   |                                   |   |
|    | (c)  | Cipher Method સમજાવો.                                 |                   |                                   | 2 |
|    |      | અથવા  |                   |                                   |   |
|    |      | Cryptographyના હેતુ જણાવો.                            |                   |                                   |   |
| 5. | નીચે | આપેલ પ્રશ્નોના તેની નીચે આપેલ વિકલ્પોમાંથી            | <u>.</u><br>યોગ્ય | ા વિકલ્પ પસંદ કરી જવાબ જણાવો :    | 7 |
|    | (1)  | CIOનું પુરૂં નામ                                      |                   |                                   |   |
|    | ( )  | (a) Chief Information Officer                         | (b)               | Critical Information Organization |   |
|    |      |   | (d)               | _                                 |   |
|    | (2)  | થોડાક સમય માટે પૂરતો પાવર જાય તેને                    |                   | ુ કહે છે.                         |   |
|    |      | (a) Blackout  | (b)               | Fault                             |   |
|    |      |   | (d)               | Spike                             |   |
|    | (3)  | Application Level Firewall ને                         | કહે છે            | ).                                |   |
|    |      | (a) Application gateway                               | (b)               | Aroxy Server                      |   |
|    |      | (c) બંને (a) & (b)                                    | (d)               | આમાંથી કોઈ નહીં                   |   |
|    | (4)  | ARPA નું પુરૂ નામ                                     |                   |                                   |   |
|    |      | (a) Auto Research Project Agency                      | (b)               |                                   |   |
|    |      | , , , , , , , , , , , , , , , , , , ,                 | (d)               | આમાંથી કોઈ નહીં                   |   |
|    | (5)  | Asymmetric Encryption ને પણ                           | . કહે             | છે.                               |   |
|    |      | (a) Public Key  | (b)               | Secret Key                        |   |
|    |      | (c) Symmetric   | (d)               | SSL                               |   |
|    | (6)  | Malicious code ને કહે છે.                             |                   |                                   |   |
|    |      | (a) Malware   | (b)               | Malicious software                |   |
|    |      | (c) બંને (a) & (b)                                    | (d)               | આમાંથી કોઈ નહીં                   |   |
|    | (7)  | Encryption and Decryptionનો મહત્ત્વનો ભ               |                   | છે.                               |   |
|    |      | (a) Key   | (b)               | Paper                             |   |
|    |      | (c) Electronic Media                                  | (d)               | આમાંથી કોઈ નહીં                   |   |
|    |      |   |                   |                                   |   |

**AF-113** 

| <b>Seat No.:</b> |  |
|------------------|--|
|------------------|--|

## **AF-113**

#### April-2016

### B.Com., Sem.-VI

## **CE-303(D): Computer Application** (Information Security)

| Time: 3 Hours] |     | [Max. Marks: 35  |        |
|----------------|-----|--|--------|
| 1.             | (a) | What is Information Security? List out characteristics of Informat  OR | ion. 3 |
|                |     | Explain:   |        |
|                |     | (1) Access   |        |
|                |     | (2) Worms  |        |
|                |     | (3) Password crack   |        |
|                | (b) | Write down all the components of information security.                 | 2      |
|                | ` ' | OR   |        |
|                |     | Write a note of "Balancing of Information Security and Access".        |        |
|                | (c) | Explain all Security Layer in detail.                                  | 2      |
|                |     | OR   |        |
|                |     | Write a note on "History of Information Security".                     |        |
| 2.             | (a) | What is Threat? List all major Threat.                                 | 3      |
|                |     | OR   |        |
|                |     | What is Attacks? Explain in detail.                                    |        |
|                | (b) | Explain:   | 2      |
|                |     | (1) Dictionary   |        |
|                |     | (2) Spam   |        |
|                |     | OR   |        |
|                |     | Explain Risk Control Strategies.                                       |        |
|                | (c) | Why Information Security is Required in Business?                      | 2      |
|                |     | OR   |        |
|                |     | Explain Risk Management.   |        |
| 3.             | (a) | Write note on VPN.   | 3      |
|                |     | OR   |        |
|                |     | What is Firewalls? List its Processing mode.                           |        |
| AF-            | 113 | 3  | P.T.O. |

|    | (D) | OR   |       |                                   | 2 |  |
|----|-----|--|-------|-----------------------------------|---|--|
|    |     | Explain:   |       |                                   |   |  |
|    |     | (1) Circuit Gateway  |       |                                   |   |  |
|    |     | (2) Hybrids Firewall   |       |                                   |   |  |
|    | (c) | Explain "Application Gateways".  |       |                                   | 2 |  |
|    | (C) | OR   |       |                                   | 4 |  |
|    |     | Explain "Firewall Categories by Structu  | re".  |                                   |   |  |
| 4. | (a) | What is Cryptography? Explain Cryptography tool.                                 |       |                                   |   |  |
|    |     | OR   |       |                                   |   |  |
|    |     | Write down difference between Digital  | Signa | ture and Digital Certificate.     | 2 |  |
|    | (b) | (b) What is Steganography? Explain.  |       |                                   |   |  |
|    |     | OR   |       |                                   |   |  |
|    |     | Explain Public Key Infrastructure.   |       |                                   |   |  |
|    | (c) | Explain Cipher Method.   |       |                                   | 2 |  |
|    |     | OR   |       |                                   |   |  |
|    |     | Explain Aims of Cryptography.  |       |                                   |   |  |
| 5. | Ans | Answer the following question by choosing proper option given at the end of each |       |                                   |   |  |
|    |     | stion:   |       |                                   | 7 |  |
|    | (1) | Give full name of CIO  |       |                                   |   |  |
|    |     | (a) Chief Information Officer  | (b)   | Critical Information Organization |   |  |
|    |     | (c) Chief Investigation Officer  | (d)   | Crime Information Officer         |   |  |
|    | (2) | (2) Complete loss of power for a moment is known as a                            |       |                                   |   |  |
|    |     | (a) Blackout   | (b)   | Fault                             |   |  |
|    |     | (c) Brownout   | (d)   | Spike                             |   |  |
|    | (3) | (3) Application Level Firewall also known as                                     |       |                                   |   |  |
|    |     | (a) Application gateway  | (b)   | Aroxy Server                      |   |  |
|    |     | (c) both (a) & (b)   | (d)   | None of the above                 |   |  |
|    | (4) | ARPA stand for   |       |                                   |   |  |
|    |     | (a) Auto Research Project Agency   | (b)   | Advance Research Project Agency   |   |  |
|    |     | (c) Advance Rate Prototype Agency  | (d)   | None of the above                 |   |  |
|    | (5) | Asymmetric Encryption also known as _  |       | ·                                 |   |  |
|    |     | (a) Public Key   | (b)   | Secret Key                        |   |  |
|    |     | (c) Symmetric  | (d)   | SSL                               |   |  |
|    | (6) | Malicious code also known as   | _•    |                                   |   |  |
|    |     | (a) Malware  | (b)   | Malicious software                |   |  |
|    |     | (c) both (a) & (b)   | (d)   | None of the above                 |   |  |
|    | (7) | a main part of Encryption and  |       | *1                                |   |  |
|    |     | (a) Key  | (b)   | Paper                             |   |  |
|    |     | (c) Electronic Media   | (d)   | None of the above                 |   |  |
|    |     |  |       |                                   |   |  |

AF-113 4